

November 28, 2025

BSE Limited, Floor 25, PJ Towers, Dalal Street, Mumbai – 400 001 National Stock Exchange of India Limited, Exchange Plaza,

Bandra Kurla Complex, Bandra (E), Mumbai - 400 051.

Scrip Code: ADANIPOWER

Scrip Code: 533096

Dear Sir/Madam,

Sub.: Newspaper advertisement - Dispatch of Notice of Postal Ballot under Section 110 of the Companies Act 2013

We would like to inform you that the dispatch of the Postal Ballot Notice dated November 21, 2025 along with the Explanatory Statement to the members of the Company was completed on November 27, 2025. The advertisements were published on November 28, 2025 in Indian Express (an English edition) and in Financial Express (a Gujarati edition), following the dispatch of the Postal Ballot Notice dated November 21, 2025.

Enclosed is the copy of the newspaper advertisements from the Indian Express (an English edition) and also from the Financial Express (a Gujarati edition), both dated November 28, 2025. This information is also available on our website, www.adanipower.com.

We request you to take the same on your record.

Thanking you,
For **Adani Power Limited**

Deepak S Pandya Company Secretary

Enclosed: As above

Adani Power Limited
"Adani Corporate House"
Shantigram, Near Vaishno Devi Circle,
S. G. Highway, Khodiyar,
Ahmedabad-382421, Gujarat India
CIN: L40100GJ1996PLC030533

Tel +91 79 2656 7555 Fax +91 79 2555 7177 info@adani.com www.adanipower.com No. P.R.O./479/2025-26

PFC CONSULTING LIMITED
(A wholly owned subsidiary of PFC Limited)

Regd. Office: First Floor, "Urjanidhi", 1, Barakhamba Lane, Connaught Place, New Delhi - 110001, (India) Fax: 011-23443990

GLOBAL INVITATION (THROUGH E-BIDDING ONLY)

FOR SELECTION OF TRANSMISSION SERVICE PROVIDER ON BUILD, OWN, OPERATE AND

TRANSFER (BOOT) BASIS FOR INTRA-STATE TRANSMISSION PROJECT IN MAHARASHTRA

PFC Consulting Limited, a wholly owned subsidiary of Power Finance Corporation Limited (A Government of India

Undertaking), invites proposals for setting up of transmission projects on Build, Own, Operate and Transfer (BOOT) basis

Interested bidders may refer to the RFP notification and RFP documents available on the website

The Bidders may obtain the RFP documents on all working days between 10:30 hrs (IST) and 16:00 hrs (IST) from 01.12.2025

to one working day prior to bid submission for the project mentioned below on payment of a non-refundable fee of Rs. 5,00,000/- or USD 7,000 plus applicable GST @18% from 9th Floor, Wing – A, Statesman House, Connaught Place,

New Delhi - 110001, Tel.: 91-11-23443996; e-mail: pfccl.itp@pfcindia.com. The RFP documents can also be downloaded

from https://www.mstcecommerce.com and https://www.pfcclindia.com, however, in such case, interested party car

submit Response to RFP only on submission of non-refundable fee of Rs. 5,00,000/- or USD 7,000 plus applicable GST

@18% separately. The survey report and clarification to RFP documents shall be issued to those bidders, who have obtained

purchased RFP documents by paying requisite fee at least one working day prior to bid submission date. Bidders should

regularly visit website to keep themselves updated regarding clarifications/ amendments/ time extensions etc., if any. The

Note: PFC Consulting Limited reserves the right to cancel or modify the process without assigning any reason and without

Bid Process Coordinator

PFC CONSULTING LTD.

(A wholly owned subsidiary of PFC Ltd.)
(A Govt. of India Undertaking)

SYMBOLIC POSSESSION NOTICE RULE 8(1) (For Immovable Property)

Whereas, the undersigned being the authorized officer of SRG Housing Finance Limited, 321, SM Lodha Complex, Near Shastri Circle, Udaipur

313001 (Raiasthan), under the Securitization And Reconstruction of Financial Assets and Enforcement Of Security Interest Act, 2002 and in exercis

of power conferred under section 13(12) read with rule 3 of Security Interest (Enforcement) Rules, 2002, issued demand notices on the date

entioned against each account calling upon the respective borrowers/co-borrowers/mortgagors/guarantors, to repay the amount within 60 days froi the date of receipt of the said notices. The borrowers/co-borrowers/mortgagors/guarantors having failed to repay the amount, notice is hereby issued to the borrowers/co-borrowers/mortgagors/guarantors having failed to repay the amount, notice is hereby issued to the borrowers/co-borrowers/mortgagors/guarantors and the public in general, that the undersigned has taken **Symbolic Possession** of the properties described herein below in exercise of powers conferred on him under section 13(4) of the said Act, read with rule 9 of the said rules, on the dates mentioned

against each account. The borrowers/co-borrowers/mortgagors/guarantors in particular and public in general are hereby cautioned **Not to deal with the properties** and any dealing with the properties will be subject to the charge of SRG Housing Finance Limited, 321, SM Lodha Complex, Near Shastri Circle Udaipur – 313001 (Rajasthan), for the amounts mentioned below plus future interest and cost/charges thereon until the realization.

The Borrowers/Co-borrowers/Mortgagors/Guarantors attention are invited to the provisions of sub-section (8) of section 13 of the said Act, in respe

3) Claim Amount As Per Demand Notice

Charges, Etc. W e f. May 08, 2025

Date Of Symbolic Possession –

3. Claim Amount As Per Demand Notice-

nterest Incidental Expenses Cost

harges, Etc. W.e.f. November 12, 2024.

Date Of Demand Notice-

November 13, 2024

November 25, 2025

1) Date Of Demand Notice

November 22, 2025

Claim Amount As Per

2) Date Of Symbolic Possession

Last Date for

seeking

clarifications

(dd/mm/yyyy)

22/12/2025

SRG HOUSING FINANCE LIMITED

CIN: L65922RJ1999PLC015440

Reg. Off: 321, S M Lodha Complex, Near Shastri Circle, Udaipur-313001(Rajasthan)

Phone: 0294-2412609 E-mail: info@srghousing.com Website: www.srghousing.com

Last Date for

submission of

response to RFF

(dd/mm/yyyy)

03/02/2026 up to

15:00 hrs (IST)

Description Of Immovable Property

Anything Attached To The Earth.)

1. Date Of Demand Notice-May 16, 2025 All That Piece And Parcel Of Land Owned By

₹ 16,05,800/- In Words Rupees Sixteen T.p. No.-69, Gram-Dindoli, Godadara, Tehsil-Surat

Lakh Five Thousand And Eight Hundred City, District–Surat (Gujarat) Having Land Area O

Only As On May 07, 2025 Plus Future 700.00 Sq. Ft. Surrounded By:- East-Adj. Land

nterest, Incidental Expenses, Cost, West-Adj. Society Road, North-Adj. Plot No. 45

t 8,42,300/- In Words Rupees Eight Lakh Having Land Area Of 675.00 Sq.ft. Surrounded By:

Forty-two Thousand And Three Hundred East- Row House No.-100, West-Row House No.

Only As On November 11, 2024 Plus Future 102, North - Common Road, South - Open Plot

South-Adi Plot No. 47

Together With Buildings And Structure

Constructed, To Be Constructed Thereon Along Wit

Fixtures And Fittings Attached To The Farth An

n The Name Mrs. Rajani Mango Borse W/o M

Mango Borse Having Plot No. 46, Avishkar Row

House, Revenue Survey No - 104/4, Block No - 104

All That Piece And Parcel Of Land Owned By: -

n The Name Mrs. Sukharjiben Rajbhar W/o M

Ramtol Having Survey No. – 59/3, 60/1, Block No.

42, I-101, Green Park Society-3, Village-Jagatpi

Tehsil-Ahmedabad, District-Ahmedabad (Gujara

SD/-

November 27, 2025

Mumbai

Authorized Officer, SRG Housing Finance Limite

following single stage two envelope process of "Request for Proposal" (RFP).

https://www.mstcecommerce.com and https://www.pfcclindia.com.

important timelines in this regard are as follows:

No.

(Dist. Raigad)

any liability. This is not an offer.

An Initiative of

Government of Maharashtra

Name of Transmission Scheme

Establishment of 765/400/220 kV AIS Dolvi

SRG HOUSING

f time available to redeem the available secured assets

rrowers/ Co-Borrowers/ Guarantors

Mrs Raiani Manno Borse W/o Mr

Mr. Govind Rajbhar S/o Mr. Ramlot (Boi

Mr. Sukharaji Rajbhar S/o Mr. Ramtol

Mr. Sukharaji Rajbhar S/o Mr. Ramtol

Mr. Amit Rajput S/o Mr. Omprakash Rajput

Mrs. Chandrakala Zala S/o Mr. Mansinh

S. Loan Account Number (Lan)/

HLR00000000020258

Borse (Co-Borrower)

HI R00000000015828

(Co-Borrower-1)

(Co-Borrower-2)

Rathod (Guarantor-2)

(Guarantor-1)

PLACE: Guiarat

November 2025.

Date : 22/11/2025 Place : Anand

(Borrower)

FINANCE LIMITED

Mr. Mango Bhaurao Borse S/o Mr. Bhaurao 2. Date Of Symbolic Possession -

HDFC BANK
| HEAD OFFICE: HDFC Bank House, Senapati Bapat Marg, Lower Parel (West)
| Mumbai - 400013 • Regional Office: HDFC Bank Ltd., Department For Specia
| Operations, 3rd Floor, C-Wing, Sheetal West Park Imperla, Nr. Alpha One Mall, Vastrapur, Ahmedabad-380015

POSSESSION NOTICE (FOR IMMOVABLE & MOVABLE PROPERTY) Whereas The undersigned being the Authorised Officer of the **HDFC Bank Ltd.**, having its Registered Office at Bank House, Senapati Bapat Marg, Lower Parel, Mumbai – 400 013

Registered Office at Bank House, Senapati Bapat Marg, Lower Parel, Mumbai – 400 013 and having one of its office at 3rd Floor, C-Wing, Sheetal West Park Imperia, Nr. Alpha One Mall, Vastrapur, Ahmedabad-380054 under the Securitisation and Reconstruction of Financial Asset and Enforcement of Security Interest Act, 2002 and in exercise of powers conferred under section 13(12) read with rule 3 of the Security Interest (Enforcement) Rules, 2002, issued a **Demand Notice** date 14.09.2021calling upon the borrower (1) **Rutuman Enterprise**, (2) **Mr. Vasant Vekariya &** (3) **Ms. Mnaishaben Vekariya** to repay the amount mentioned in the notice being Rs. 59,32,164.66/- (Rupees Fifty Nine Lakh Thirty Two Thousand One Hundred Sixty Four and Paise Sixty Six) as on 06.09,2021 teachers with interest theorem within 60 days from the date of progrets of the said active.

ogether with interest thereon within 60 days from the date of receipt of the said notice.

The borrower, guarantor/s, mortgagor/s and legal heir in case of deceased (if any) having

failed to repay the amount, notice is hereby given to the borrower, guarantor/s mortgagor/s and legal heir in case of deceased (if any) in particular and public, in general

that the undersigned being the Authorised officer of HDFC Bank Ltd., has taken physical possession of the property described herein below in excercise of powers conferred on him under section 13(4) of the said Act read with rule 8 of the said Rules on this 22nd

The borrower, guarantor/s, mortgagor/s and legal heir in case of deceased (if any) in particular, and the public, in general, are hereby cautioned not to deal with the property and any dealing with the property will be subject to the charge of the HDFC Bank Ltd., for an amount of Rs. 59,32,164.66/- (Rupees Fifty Nine Lakh Thirty Two Thousand One Hundred Sixty Four and Paise Sixty Six) together with interest thereon as aforesaid.

The borrower, guarantor/s, mortgagor/s, and legal heir in case of deceased (if any) attention is invited to provisions of Sub section (8) of Section 13 of the Act, is respect of time available, to redeem the secured asset.

Description of Movable and Immovable property A. Stock in trade, consisting of raw materials, goods in process of manufacturing finished goods, and other merchandise whatsoever being movable properties, now stored at or

eing stored or which may hereafter be brought into or stored at the premises, factories of

varehouse or at any such place of the borrower, any of the above which is or may be in

warehouse or at any such place of the borrower, any of the above which is or may by or premises or at any other place whatsoever and wheresoever in the borrowers factory or premises or at any other premises or place and/or B. All the debts, that is, all contract, debts, outstandings, monies receivables, claims, bills, invoice documents, contract, guarantees, and rights which are now due and owing or which may at any time hereafter during the continuance of this security becomes due and owing to the borrower in the course of its business by any person, firm, company or body corporate or by a government department or office or any municipal or local or public or semi government body or authority or anybody corporate or undertaking or project whatever in the public sector.

authority or anybody corporate or undertaking or project whatever in the public sector. C. The Property bearing Bungalow R. S. No. 470/2/Piki 2, total adm. Hec0-09-10 are N.A. Land paiki Sub Plot No. 3, Total admeasuring 207.15 Sq. Mtrs. Mouje Karamsad, Registration District and Dist Anand. Owned by Mr. Vasanthhai Vekariya and Ms. Mnaishaben Vasanthhai Vekariya Admeasuring land 207.15 Sq. Mtrs. Boundary Details: North: S. No. 466, South: S. P. No. 4, East: S. No. 466, West: S. P. No. 2 D. T. h. e. Persenth: Boundary City. Street No. 2 D. T. h. e.

North: S. No. 4bb, South: S. F. No. 4, East: S. No. 4b5, West: S. F. No. 2 D. 1 n e Property bearing City Survey No. 1163, Plot No. K/2, Total adm. 841.79 Sq.Mt. as or organized "Purohit Arcade" piki upper ground floor shop No. AF/4, builtup area 29.35 along with undivided share land 24.45 Sq. Mtrs. Mouje Vallabh Vidhyanagar, Registration District and Dist. Anand. Owned by Mr. Vasant Vekariya. Admeasuring land 29.35 Sq. Mtrs. Boundary Details: North: Margin, South: Shop F-3, East: Passage, West: Margin (All gift bem bargin after collectively referred to as "secured seste").

Anil Sankhla, Authorised Office

Department For Special Operations, HDFC Bank Ltd.

Margin (All of them herein after collectively referred to as "secured asset")

Date: 26/11/2025

WESTERN RAILWAY - BHAVNAGAR DIVISION

TENDER FOR THE CONTRACT OF ADVERTISEMENT BOARD - RAILWAY DISPLAY NETWORK (RDN)

Catalouge No: ADVT-RDN-2025-5

Type of Contract: Advertisement Board - Railway Display Network (RDN)

Category: ADVERTISEMENT

Bidder/Tenderer shall be required to visit (IREPS/E-Auction) site or for more queries may be visit divisional office Bhavnagar or Telephonic (Commercial inspector (NFR), Bhavnagar Division - +91-72279 89486). Time and Date for Auction start: 11:00 Hrs. on 10.12.2025 through

ike us on: facebook.com online website www.ireps.gov.in Time and Date for Auction Closing: 11:40 Hrs. on 10.12.2025 through online website www.ireps.gov.in



Material

LIME

NMDC STEEL LIMITED (A Government of India Enterprises) Post-Nagarnar (Bastar), Chhattisgarh-494001 CIN:L27310CT2015GO1001618

GLOBAL TENDER NOTICE Tender No: NSL/SP-4857/CALCINED LIME/GTE MSTC Tender No: NSL/Nagarnar/Materials/13/25-26/ET/34 Date: 28/11/2025 escription of Display of Tender Last Date & Time for Earnest Money Qty (MT) Document Period | Submission of offer

26.12.2025

by 03:00 PM (IST) 60,000 US Dolla

Rs.50,00,000/-

Complete Tender document is available in website www.nmdc.co.in & http:// eprocure.gov.in and https://www.mstcecommerce.com/eproc/. Any corrigendum to the above tender will be uploaded only on our website www.nmdc.co.in & MSTC Por tal. Prospective bidders should visit NMDC Limited website & MSTC Portal from time to time to take note of corrigendum, if any. For further details logon to Tender Section of our website: www.nmdc.co.in Chief General Materials (MM & Cont.)

28.11.2025 To

26.12.2025



No. Name of the Department

SURAT MUNICIPAL CORPORATION

Drainage Department e Tender (On line) invitation Notice No. DMC/Drainage/08/2025-26.

Online tenders are invited on https://smctender.nprocure.com for the various works of drainage department, from the Government approved contractors of relevant class.

	rame or the Bepar timent	- aminage
I	No of the works	21
2	Total Estimated cost of Tender Rs. in Lacs	40115.687

The detail tender notice will be made available at above

address and on website www.suratmunicipal.gov.in No. P.R.O./482/2025-26 Deputy Municipal Commissioner (D) Surat Municipal Corporation Date: 26-I I-2025

PUBLIC NOTICE

ENVIRONMENTAL CLEARANCE t is hereby informed that the State Level Environment Impact

Assessment Authority (SEIAA), Paryavaran Bhavan, Sector 10A, Gandhinagar – 382 010, has accorded Environmental Clearance for Proposed industrial shed for Line 4 of M/s. Honda Motorcycle & Scooter India Private Limited at Village: Vithalpur, Taluka : Mandal, District, Ahmedabad-382120 Gujarat, vide order beaning EC Identification No.EC25C3806GJ5428444N dated 21st November, 2025

Copies of Environmental Clearance letter are availabe at office and on website of MoEF&CC https://parivesh.nic.in

Authorized Signatory Date:28-11-2025

M/s Honda Motorcycle & Scooter india Pvt Ltd.

રાજકોટના મે.જી.ડી. ચાદવ, જજ સાહેબની ફેમીલી કોર્ટમાં **જુની કલેકટર ઓફીસ કેમ્પસ, રાજકોટ.** ફેમીલી કોર્ટ ને. ર, ફેમિલી સ્થુટ ને.: ૧૬૫/૨૦૨૪, મુદત તા.: ૦૫-૧૨-૨૦૨૫

જાહેર નોટીસ ઘર્મે : હિન્દુ ઉ.વ. આ. ૪૯, ઘંઘો : ઘરકામ

રહે : વ્રજ ભૂમિ, બ્લોક નં. ૪૬, જીવરાજ ટાઉનશીપ, નાના મવા રોડ, અંબિકા ટાઉનશીપ, રાજકોટ

<u>વિરૂધ્ધ</u>

કિરીટભાઇ ગોપાલભાઇ બટાણી દ્યર્ને : દિન્દુ, ઉ.વ.આ. ૫૦, દાંદ્યો : ખેતી

રહે. : ભાચાણી ચોક, જુના પટેલ સમાજ ચોક, મું. સુપેડી, તા. ઘોરાજી, જી. રાજકોટ. આથી તમો ઉપરોક્ત ફેમિલી સ્થુટ નં. ૧૬૫/૨૦૨૪ ના સામાવાળાને આ જાહેર નોટીસથી જા જારા દેશો જ વધારા કુલાવા કરેવું. એ. 37 સ્ટલ્ટ એ માના માના ભાગ તાર બાઇકારા તાર કરવામાં આવે છે કે, આ કોર્ટ સમક્ષ અસ્પષ્ટદારએ ફિલ્દુ મેરેજ અદીશિયમ-૧૯૫૫ ની કલા-૧૩(એ) અન્વચે છુટાછેડા મળવા અંગે દાવો દાખલ કરેલ છે અને સદર દાવાની મુદત તારીખ ૦૫-૧૨-૨૦૨૫ ન

રોજ મુકરર કરવામાં આવેલ હોય, જેથી તમો સામાવાળા અત્રેની કોર્ટમાં મુદત તારીખ ૦૫-૧૨-૨૦૨૫ ના રો૧ હાજર રહેશો. ગેરહાજર રહે નિયમાનુસાર યોગ્ય હુકમ કરવામાં આવશે, જેની નોંધ લેવી. આજ રોજ તારીખ ર૦ મી માહે નવેમ્બર, ૨૦૨૫ ના રોજ મારી સહી તથા સિકકો કરી આપ્યુ. પ્રો.જા.નં. ૭૮૨/૨૦૨૫ દુકમથી તૈયાર કરનાર

(પી.જે. ગોહિલ) આસી. સુપ્રીન્ટેન્ડન્ટ ફેમિલી કોર્ટ, રાજકોટ



મુકાબલ કરનાર (આર.એમ. ઝાલા) બેંચ કલાર્ક-ગ્રેડ ૧

રજીસ્ટ્રાર

(એમ.એસ. ચૌફાણ) ફેમિલી કોર્ટ, રાજકોટ ફેમિલી કોર્ટ, રાજકોટ

....અરજદાર

Government of India Ministry of Commerce & Industry

Department of Commerce ADVERTISEMENT FOR ENGAGEMENT OF INDEPENDENT CONSULTANTS IN DEPARTMENT OF COMMERCE, NEW DELHI.

The Department of Commerce invites applications for the positions of Young Professionals, Associates, Consultants and Senior Consultants in the streams of Economics, General Management, Data Science and Legal, on purely contractual basis. Guidelines for engagement of Independent Consultants in the Department of Commerce is available a (https://www.commerce.gov.in/engagement-of-ics/). Interested and eligible candidates may apply online through the following link: Engagement www.commerce.gov.in (https://apps.commerce.gov.in/recruitment/) from 01.12.2025 to 10.12.2025. No hard copy is required to be sent. For any further query, candidates may approach this office at recruitment-e2@gov.in.

Under Secretary to the Government of India CBC-05101/11/0004/2526 Department of Commerce



रानी लक्ष्मी बाई केंद्रीय कृषि विश्वविद्यालय, झाँसी Rani Lakshmi Bai Central Agricultural University, Jhansi ग्वालियर रोड, झाँसी-284003 (उत्तर प्रदेश) Gwalior Road, Jhansi -284003 (U.P.)

Advertisement No: RLBCAU/8/2025 स्नातक, स्नातकोत्तर और पीएचडी में प्रवेश के लिए आवेदन/

Application for UG /PG and Ph. D. Admission

रानी लक्ष्मी बाई केंद्रीय कृषि विश्वविद्यालय के विभिन्न रनातक, रनातकोत्तर औ पीएचडी पाठ्यक्रमों में प्रवेश के लिए संबंधित श्रेणियों के तहत रिक्त सीटों के लिए प्रवेश लेने के इच्छुक पात्र एवं वैध आईसीएआर रैंक कार्ड धारक उम्मीदवारों से (प्रवेश शैक्षणिक सत्रू 2025—26 के लिए) आवेदन आमंत्रित किए जाते हैं, अधिक जानकारी के लिए कृपया विश्वविद्यालय की वेबसाइट <u>www.rlbcau.ac.in</u> देखें।

पंजीकरण 28.11.2025, सुबह 10.00 बजे से 30.11.2025 सायं 05.00 बजे तक होगा। प्रवेशित छात्रों को कोई एनटीएस / विश्वविद्यालय फैलोशिप प्रदान नहीं की जाऐगी। Applications are invited from eligible and valid ICAR rank card holder Applications are invited from eligible and valid ICAR raink dard holder candidates desirous of taking admission on vacant seats under the respective categories for admission to various UG/PG and PhD courses of Rani Lakshmi Bai Central Agricultural University (Admission Academic Session 2025-26). Kindly see the university's website www.rlbcau.ac.in for more information.

Registration will start from 28.11.2025, 10.00 A.M. to 30.11.2025 till 05.00 P.M., no NTS / University Fellowship will be awarded to the admitted कुलसचिव / Registrar

WESTERN RAILWAY **BHAVNAGAR DIVISION**

PROVISION OF CCTV

CAMERAS The Divisional Railway Manager (Commercial), Western Railway, Bhavnagar Para invites tenders for Provision of CCTV cameras at 05 Goods sheds i.e. Junagadh, Adri Road, Vartej, Gondal Bhavnagar Timber Depot The tender has been published on IREPS website for which details are as follows: **Tender No.**: 03-2025-26 Date of Uploading of tender: 26/11/2025 Date and time for closing submission of proposals: 18/12/2025,15:00 hours Tender value (in Rs.): ₹64,04,434.30/- EMD in Rs.: ₹1,28,100/- Tender document available at Indian Railway web site: https://www.ireps.gov.in/

CORPORATION FIT West Zone (Rander) e-Tender (Online) invitation Notice No. **Addi. City Engineer / WZ / 12/ 2025-26** Tender are invited for various Dept. works online on https://smctender.nprocure.com from Government approved contractors / Agencies with following schedule. Name of the Department Strom Drainage Light No. of Work 01 Total Nos. 09 (Nine) of works Total Estimated Rs. 28,13,68,028=26 cost of Tender The detail tender notice will be made available on website BVP204 www.suratmunicipal.gov.in

SURAT MUNICIPAL

Addi. City Engineer

West Zone (Rander)

Surat Municipal Corporation

Date of opening

of Response

to RFP

(dd/mm/yyyy)

03/02/2026 at

15:30 hrs (IST)

Initiative Partner

State Transmission Utility

Maharashtra

PUBLIC NOTICE

All the concerned persons are hereby informed that the project 'Product mix change without increase in production capacity of Existing Fertilizer Plant for Manufacturing of Nano NPK Fertilizer (Nano Fertilizer), Kandla Plant at P.O. Box No. 12, Kandla, District-Kutch, Gujarat by M/s Indian Farmers Fertiliser Cooperative Limited (IFFCO)" has been accorded environmental clearance vide F.No. J-11011/202/2009-IA II(I) Dated 31st October 2025 by the Ministry of Environment, Forest & Climate Change, Gol and copies of the clearance letter are available with the MoEF&CC and may also be seen at Website of the Ministry at https://parivesh.nic.in/.

CORRIGENDUM the undersigned being the au Whereas.

officer of SRG Housing Finance Limited, 321, SM Lodha Complex, Near Shastri Circle, Udaipu (Raiasthan) (CIN 165922R I1999PI C015440 the powers conferred by Section 13(12) read wit Rule 3 of the Security Interest (Enforcement Rules, 2002, has taken Physical possession of th mortgaged property and the information of which was published in English language in the "INDIAN EXPRESS" on 27-11-2025 bearing the Loan Account No. HLR00000000003877, HLR00000000003720, HLR000000000017669, HLR00000000007252, HLR00000000016485, HLR00000000015790 and HLR00000000014227 and written "Symbolic Possession" which in future should be read and understood as "Physical Possession". Place- GILIARAT Authorized Office Publication Date – 28/11/2024 SRG Housing Finance Limited, Udaipur

adani Power

Adani Power Limited

POSTAL BALLOT NOTICE

The Members of Adani Power Limited (the "Company") are hereby informed that pursuant to provisions of Sections 110 and 108 and all other applicable provisions, if any, of Companies Act, 2013 (the "Act"), read with Rules 20 and 22 of the Companies (Management and Administration) Rules, 2014 (the "Rules"), Secretarial Standard on General Meetings issued by the Institute of Company Secretaries of India (the "SS-2"), Regulation 44 of the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015 (the "SEBI Listing Regulations") including any statutory modification(s), substitution(s) or re-enactment(s) thereof for the time being in force and General Circular dated 19th September 2024 issued by the Ministry of Corporate Affairs (the "MCA") read along with other connected circulars issued from time to time in this regard (the "MCA Circulars") and any other applicable law, rules and regulations (including any statutory modification(s) or re-enactment(s) thereof, for the time being in force), the Company seeks the approval of the Members for the Special Businesses by way of requisite resolutions, as set out in the postal ballot notice dated 21st November 2025 along with the explanatory statement (the "Notice"), by way of electronic means (i.e. remote e-voting) only.

The electronic copies of Postal Ballot Notice ("Notice") along with the Explanatory Statement has been dispatched on Thursday, 27th November 2025, to those Members whose names appear on the Register of Members/List of Beneficial Owners as received from the National Securities Depository Limited ("NSDL") and Central Depository Services (India) Limited ("CDSL") as on Friday, 21st November, 2025 ("Cut-Off date") and who have registered their e-mail addresses with the Company / Depositories. Physical copies of the Postal Ballot Notice along with Postal Ballot forms and pre-paid business reply envelopes are not being sent to Members for this Postal Ballot in line with the exemption provided in the MCA Circulars. The documents referred to in Postal Ballot notice are available for inspection and members seeking inspection can send an email to deepak.pandva@adani.com.

Notice is available on the website of the Company i.e. www.adanipower.com and of the Stock Exchanges i.e. BSE Limited and the National Stock Exchange of India Limited at www.bseindia.com and www.nseindia.com respectively and of the CDSL at www.evotingindia.com

In light of the MCA Circulars, Members who have not registered their e-mail address and in consequence could not receive the Postal Ballot notice may temporarily get their email address registered with the Company's RTA, M/s. KFin Technologies Limited, by clicking the link: https://karisma.kfintech.com/emailreg. Post successful registration of the e-mail, the member would get soft copy of the notice and the procedure for e-voting along with the User ID and Password to enable e-voting for this Postal Ballot. In case of any queries, member may write to einward.ris@kfintech.com.

The Company provides the Members the facility to exercise their right to vote by electronic means through E-voting services provided by Central Depository Services (India) Limited ("CDSL"). The detailed instructions for E-voting have been provided in the

The remote E-voting facility is available during the following period:

Commencement of E-voting	9:00 a.m. (IST) on Saturday, 29" November, 2025
Conclusion of E-voting	5:00 p.m. (IST) on Sunday, 28 th December, 2025

The remote e-voting module shall be disabled by CDSL for voting thereafter. During this period, Members holding shares either in physical form or in dematerialized form as on Friday, 21st November, 2025 ("Cut-Off date") may cast their vote by e-voting.

Once the vote on a resolution is cast by the Member, he/she is not allowed to change it subsequently. The voting rights of the Members shall be in proportion to their share of the paid-up equity share capital of the Company as on the Cut-off date i.e. Friday, 21st November, 2025. A person who is not a member as on the cut-off date should treat this Notice for information purpose only. The Board of Directors of the Company has appointed Mr. Chirag Shah, (Membership No FCS: 5545; CP No.: 3498) or failing him Mr. Raimeen Maradiya (Membership No. FCS

11283, CP No.: 17554), Partners of M/s. Chirag Shah and Associates, Practicing Company Secretaries as the Scrutinizer for conducting the postal ballot process in a fair and The Scrutinizer will submit his report to the Chairman or any authorised person of the

Company, and the results of the Postal Ballot will be announced within two working days of conclusion of E-voting. The said results would be displayed at the Registered Office of the Company and intimated to the National Stock Exchange of India Limited ("NSE") and BSE Limited ("BSE") where the shares of the Company are listed. Additionally, the results will also be uploaded on the Company's website www.adanipower.com and on the website of CDSL www.evotingindia.com.

In case you have any queries or issues regarding e-voting, you may refer the Frequently Asked Questions ("FAQs") and e-voting manual available at www.evotingindia.com under help section or write an e-mail to helpdesk.evoting@cdslindia.com. or contact Mr. Rakesh Dalvi, Sr. Manager, at 25th Floor, A Wing, Marathon Futurex, Mafatlal Mills Compound, NM Joshi Marq, Lower Parel (E), Mumbai - 400 013; Email: helpdesk.evoting@cdslindia.com on 022-23058542/43 during working hours on all working days.

For, Adani Power Limited

Deepak S Pandya Company Secretary

Date: 27th November 2025 Place: Ahmedabad

Registered Office: "Adani Corporate House", Shantigram, Near Vaishno Devi Circle,

S. G. Highway, Khodiyar, Ahmedabad - 382421, Guiarat, India. Phone No.: +91 79 2555 7555 | Fax No.: +91 79 2555 7177 Website: www.adanipower.com | CIN: L40100GJ1996PLC030533

1 TATA

TATA STEEL LIMITED

Registered Office: Bombay House, 24, Homi Mody Street, Fort, Mumbai 400 001, India Tel No: +91 22 6665 8282 E-mail: cosec@tatasteel.com Website: www.tatasteel.com Corporate Identification Number: L27100MH1907PLC000260

NOTICE TO SHAREHOLDERS

Securities and Exchange Board of India (SEBI) vide its circular no, SEBI/HO/MIRSD/MIRSD-PoD/P/CIR/2025/97, dated July 2, 2025 has allowed the opening of special window to facilitate re-lodgment of transfer requests of shares held in physical form, lodged prior to the deadline of April 1, 2019 and rejected/returned due to deficiency in the documents. Hence, investors who missed the earlier deadline of March 31, 2021 for re-lodgment are requested to submit necessary documents with the Company's Registrar and Share Transfer Agent by following the details as given below:

	Key Details					
Window for re-lodgement	July 7, 2025 to .	uly 7, 2025 to January 6, 2026				
Who can relodge the transfer requests?		vestor whose transfer deeds were lodged prior to April 2019 and rejected/returned due to efficiency in documents.				
How to relodge the transfer requests?	y original transfer documents with corrected or missing details to the Registrar and gent, MUFG Intime India Private Limited (Formerly known as Link Intime India					
Unit: 1		MUFG Intime India Private Limited Unit: Tata Steel Limited C 101, Embassy 247, L.B.S Marg, Vikhroli (West), Mumbai - 400083				
	Helpline no.	+91 81081 18484				
	For any queries	Raise a service request at : https://web.in.mpms.mufg.com/helpdesk/Service_Request.html or send an email at cosec@tatasteel.com or/and at investor.helpdesk@in.mpms.mufg.com				

The shares re-lodged for transfer shall be issued only in demat mode

Tata Steel Limited

Parvatheesam Kanchinadham Company Secretary and Chief Legal Officer

ACS: 15921

TATA STEEL

Bilcare^{*} Research

Bilcare Limited

Address: 301, Kamal Kunj, 8 Shivaji Housing Society, Pune - 411016 Ph. No.: + 91 20 6600 7559 / 8484883639 Email : fd@bilcare.com

Notice

In continuation to the various communications and earlier public notice published on 14th November 2025, final notice is hereby given to the Public Fixed Deposit holders of Bilcare Limited who have not yet sent their Fixed Deposit Receipts to the Company. Kindly send the Fixed Deposit Receipts for payment, duly discharged by all the holders by affixing the revenue stamp and the signature(s) of Holders including Joint Holders, if any on the reverse side at the above address along with: 1) A self-attested copy of PAN card; and

2) Bank Account details (cancelled cheque or copy of first page of pass

Kindly note that if the Fixed Deposit Receipt is not received by $28^{\rm m}$ February 2026, the Company will commence the process for transferring the unclaimed amounts to Investor Education & Protection Fund of the Government of India. For Bilcare Limited

Sagar R. Baheti Date: November 27, 2025 Company Secretary

U. P. Power Corporation Ltd.

IT Unit, 5th Floor, Shakti Bhawan Ext., Lucknow-226001 Email: etender itunit@uppcl.org

Notice inviting Tender Date: 27-11-2025 e-Bids are invited from interested bidders against E-tender No. 03/IT/UPPCL/WhatsApp, RCS and Chatbot Solutions /2025 Dated 27.11.2025 for Engagement of an Agency for Providing WhatsApp Business API, RCS Services and Chatbot Solutions for UPPCL/Discoms. Tender can be downloaded from UP e-tender portal https://etender.up.nic.in for further details. Any changes, corrigendum etc. shall also be notified on the website. UPPCL reserves the right to reject any or all proposals or cancel the bid without

पत्रांक- 26-ज.स./पाकालि./ज.स./2025 दिनांक 27.11.2025

assigning any reason thereof.

પરિશિષ્ટ IV-એ. સ્થાવર મિલકતના વેચાણ માટે સૂચના

સિક્યોરીટી ઈન્ટ્રેસ્ટ (એન્ફોર્સમેન્ટ) એક્ટ 2002ના નિયમ 8(6) અને નિયમ 9(1) મુજબ सिड्योरिटाઈडेशन એन्ड रिडन्स्टर्ड्शन ओइ डाઈनान्शियस એसेट्स એन्ड એन्डोर्समेन्ट સિક્યોરીટી ઈન્ટ્રેસ્ટ એક્ટ 2002 હેઠળ સ્થાવર મિલકતના વેચાણ માટે ઈ-ઓક્શન વેચાણ સૂચના. આ દ્વારા સામાન્ય જનતાને અને ખાસ કરીને કર્જદાર(રો) અને ગૅરંટર(રો)ને સૂચના આપવામાં આવે છે

ક, નીચે વર્ણન કરેલ સ્થાવર મિલકત કે જે **સમ્માન કંપિટલ લિમિટેર્ડ (આ પહેલા ઈન્ડિયાબુલ્સ** હાઉસિંગ ફાઈનાન્સ લિ. તરીકે ઓળખાતી) [CIN : L65922DL2005PLC136029] ("સીક્ચોર્ડ **ક્રેડિટર'')** પાસે ગીરવે મુકેલ છે જેનો **વાસ્તવિક કબજો** સીક્યોર્ડ ક્રેડિટરના અધિકૃત અધિકારી દ્વારા નેવામાં આવ્યો છે તે **ર. 29,54,311/- (રૂપિયા ઓગણત્રીસ લાખ ચોપ્પન હજાર ત્રણસો અગ્યાર** પૂરાં) ની વસૂલી માટે 16.12.2025 ના રોજ સાંજના 05.00 થી 06.00 વાગ્યા સુધી ''જેમ છે જ્યાં છે'' . જેમ છે જે છે" અને ''જે પણ જયાં છે" દ્યારણે વેચવામાં આવશે, જે **દરેશભાઈ રામજીભાઈ દેસાઈ,** વિલાસબેન હરેશભાઈ દેસાઈ ઉર્ફે દેસાઈ વિલાસબેન હરેશભાઈ અને જયંતીભાઈ નારણભાઈ તલાવીચા ઉર્ફે તલાવીચા જચંતીભાઈ નારણભાઈ પાસેથી લોન અકાઉન્ટ નં. HHLSUR00450677 માં બાકી નીકળતી મૂળ રકમ, એરીઅર્સ (જમા થયેલા લેટ ચાર્જિસ સદિત) તેમ જ **19.11.2025** સુધીના વ્યાજ સહિત લોન એગ્રીમેન્ટ અને અન્ય સંબંધિત લોન દસ્તાવેજ(જો)ની શરતો મુજબ 20.11.2025 થી અમલી બને તેમ લાગુ ભાવિ વ્યાજ ઉપરાંત કાનૂની ખર્ચ અને અન્ય ચાર્જિસ સહિત સીક્યોર્ડ ક્રેડિટર્સને ચૂકવવાના બાકી નીકળે છે.

સૂચિત પ્રોપર્ટીઓના ઓક્શન માટે અનામત કિંમત **રૂ. 13,00,000/- (રૂપિયા તેર લાખ પૂરાં)** છે. અને અર્નેસ્ટ મની ડિપોઝિટ **(''ઈએમડી'') રૂ. 1,30,000/- (રૂપિયા એક લાખ ત્રીસ દજાર પૂરાં)** એટલે અનામત મૂલ્ય 10 % ના બરાબર રહેશે.

સ્થાવર મિલકત્તનું વર્ણન

સુરત જિલ્લો, પેટા જિલ્લો તાલુકા કામરેજ, મોજે ગામ નાણસદ રેવેન્યૂ સર્વે નં. 111, બ્લૉક નં. 119 (નવો બ્લૉક નં. 141), જેનો હેક્ટર આરે 1-09-40 ચો. મીટર (નવો એરિયા હેક્ટર આરે 1-13-20 ચો. મીટર) ની રहેણાંક हેતુ માટેની બિન-ખેતીની જમીન છે^{ં,} જે "પરિવાર રેસિકેન્સી" તરીકે ઓળખાય છે, રહેણાંક હેતુ માટે પ્લૉટ નં. 57 પર જેનો સાઈટ એરિયા વિસ્તાર 89.19 ચો. મીટર (મંજૂર થયેલ પ્લાન અનુસાર એરિયા 89.06 ચો. મીટર), તે સાઈટ પ્લૉટ્સ પૈકી દક્ષિણ બાજુનો પ્લૉટ જેનો વિસ્તાર 44.59 ચો. મીટર છે જે સાઈટ પર ખુલ્લા પ્લૉટની પ્રોપર્ટી છે જેને પ્લૉટ નં. 57 ફાળવવામાં આવ્યો છે અને તેને સંલગ્ન સીઓપી, રોડ તેમ જ 17.84 ચો. મીટર વિસ્તારની જમીનનો સરેરાશ અવિભાજિત હિસ્સા સહિત અંદર અને બહાર સંચુક્ત ઉપયોગની મિલકત. સીમાઓઃ

પૂર્વમાં : સોસાયટીનો આંતરિક રસ્તો પશ્ચિમમાં **ः प्लॉटनं.** 56

ઉત્તરમાં : પ્લૉટ નં. એ - 57 **દક્ષિણમાં : પ્લૉટ નં.** 58

અધિકત અધિકારી

વેચાણના વિસ્તૃત નિયમો અને શરતો માટે કૃપા કરી સીક્યોર્ડ ફ્રેડિટર એટલે કે www.sammaancapital.com ની વેબસાઇટ પર આપેલી લિંક જૂઓ; સંપર્ક ન. 0124 - 6910910, +91 7065451024; ઈ-મેલ આઈડી : auctionhelpline@sammaancapital.com. બિડિંગ માટે www.auctionbazaar.com પર લૉંગ ઑન કરો

તારીખ : 20.11.2025 સ્થળ : સુરત

સમ્માન કૅપિટલ લિમિટેડ (આ પહેલા ઈન્ડિયાબુલ્સ हાઉસિંગ ફાઈનાન્સ લિ. તરીકે ઓળખાતી)



TRANSCHEM LIMITED

(CIN: L66120MH1976PLC019327) Regd. Office: 111, Maker Chambers IV, 11th Floor, Nariman Point, Mumbai, 400021 Tel.: 022 4334 7000 Telefax : 022 4334 7002 E-mail: secretary@transchem.net Website: www.transchem.net

NOTICE OF THE SECOND EXTRA-ORDINARY GENERAL MEETING FOR THE FINANCIAL YEAR 2025-26 AND REMOTE E-VOTING INFORMATION

NOTICE is hereby given that the 2nd Extra-Ordinary General Meeting ("EGM") of Transchem Limited ("the Company") for the financial year 2025-26 is scheduled to be held on Saturday, December 20, 2025 at 11:00 a.m. (IST) through Video Conferencing ("VC")/Other Audio Visual Means ("OAVM") only, to transact the businesses as set out in the Notice of the EGM. Pursuant to the Ministry of Corporate Affairs ("MCA") General Circular No. 03/2025 dated September 22, 2025 read with earlier circulars issued by the MCA in this regard and Securities and Exchange Board of India ("SEBI") Circular no. SEBI/HO/CFD/CFD-PoD-2/P/CIR/2024/133 dated October 3, 2024, the Company has sent the Notice of EGM, through electronic mode only, to those members whose e-mail addresses are registered with the Company/Depositories/Registrar and Share Transfer Agent ("RTA") as on Friday, November

The Notice of EGM along with Explanatory Statement and other documents are also available on the website of the Company at www.transchem.net and can also be accessed from at relevant section of the website of the Stock Exchange i.e. BSE Limited ("BSE") viz. www.bseindia.com. The EGM Notice is also available on the website of National Securities Depository Limited ("NSDL") at

www.evoting.nsdl.com. Members are further informed as follows:

NSDL is appointed to provide a platform for convening the meeting through VC to handle and supervise the entire process of holding the meeting through VC, e-voting, and processing of data relating to the meeting and voting, etc. Further, members can join and participate in the EGM through VC/OAVM facility only. The instructions for joining and manner of participation in the EGM are provided

- The Company is providing the facility of remote e-Voting to the Members and e-Voting at EGM to exercise their rights to vote on the resolutions proposed to be passed at the EGM
- The Company has fixed Saturday, December 13, 2025 as the Cut-off date for determining the members eligible to vote on all resolutions set out in the EGM Notice.
- The Remote e-Voting period commences on Wednesday, December 17, 2025 at 09:00 a.m (IST) and will conclude on Friday, December 19, 2025 at 05:00 p.m. (IST). The Remote e-Voting will not be permitted beyond 05:00 p.m. (IST) on Friday, December 19, 2025. Members holding shares in physical mode and who have not updated their e-mail address with
- the Company are requested to update their e-mail addresses by submitting Form ISR-1 (available on the website of the Company www.transchem.net) duly filed and signed along with requisite supporting documents to the Company's RTA.
- Members holding shares in dematerialised mode are requested to register/update their e-mai
- address with the relevant Depository Participants. The instructions for joining the EGM and the manner of participation in the remote electronic voting or casting vote through the e-Voting system during the EGM are provided in the Notice
- The manner of voting remotely or during the EGM for Members holding shares in dematerialized mode, physical mode and for Members who have not registered their email addresses has been provided in the Notice convening the EGM. Instructions for attending the EGM through VC / OAVM are also provided in the Notice of the EGM.
- Members who have cast their vote through remote e-voting can participate in the EGM but shall not be entitled to cast their vote again
- In case of any queries, Members may refer the Frequently Asked Questions (FAQs) for Shareholders and e-voting user manual for Shareholders available at the download section of www.evoting.nsdl.com or call at 022-4886 7000 or send a request to Mr. Sagar S. Gudhate

(Senior Manager) at evoting@nsdl.com. Members are requested to carefully read the Notice of the EGM and in particular, instruction for joining the EGM, manner of casting vote through remote e-Voting or Voting at the EGM. By Order of the Board of Directors

Place: Mumbai Date: November 21, 2025

ધી મહેસાણા અર્બન કો-ઓપ.બેન્ક લિ. મહેસાણા (મલ્ટી સ્ટેટ શિડચુલ્ડ બેન્ક) હેડ ઓફિસ :કોર્પોરેટ બિલ્ડીંગ,હાઇવે, મહેસાણા-૩૮૪૦૦૨ ફોન નં. (૦૨૯૬૨) ૨૫૯૨૩૩, ૨૫૯૨૩૪

ઉધાર લેનારને સૂચના

(સરફેસી અધિનિયમ, ૨૦૦૨ ની કલમ ૧૩ ની પેટા-કલમ (૨) હેઠળ) રજિસ્ટર્ડ એ.ડી./કુરિયર દ્વારા (અમારી અગાઉની ૦૩.૦૫.૨૦૨૫ ની માંગણી સૂચના પાછી ખેંચી લેવામાં આવી છે.)

તોયમ સેફ વોટર ટેક્નોલોજીસ શેડ નં. ૧૨, સનશાઇન ઇન્ડસ્ટ્રીઝ એસ્ટેટ, ભાગ્યોદય હોટેલ પાસે, ચાંગોદર, અમદાવાદ-૩૮

ભાગીદારો :-(૧) શ્રી સ્નેહ અનિલ ત્રિવેદી

સવિધાની પ્રક્રૃતિ અને

ઈ-૧૩૦૩, સોરેલ એપાર્ટમેન્ટ એપલવુડ ટાઉનશીપ, શાંતિપુરા સર્કલ પાસે, દક્ષિણ બોપલ, અમદાવાદ, ગુજરાત-૩૮૦૦૫૮. (૨) શ્રીમતી પૂજા સ્નેહ ત્રિવેદી ઈ-૧૩૦૩, સોરેલ એપાર્ટમેન્ટ એપલવુડ ટાઉનશીપ, શાંતિપુરા સર્કલ પાસે, દક્ષિણ બોપલ, અમદાવાદ, ગુજરાત-૩૮૦૦૫૮..

અમારી બોપલ શાખા સાથે ક્રેડિટ સુવિધાઓ.

---મર્યાદા રૂ.

ા.અમે ૧૯.૦૫.૨૦૨૨ ના અમારા પત્ર અને ત્યારબાદના નવીકરણ/સમીક્ષા નોંધનો ઉલ્લેખ કરીએ છીએ, જે ૧૧.૦૫.૨૦૨૩ ના રોજની છેલ્લી નોંધમાં વિવિધ ક્રેડિટ સુવિધાઓની મંજૂરી અને મંજૂરીની શરતો દર્શાવતી નં.શૂન્ય છે.ઉપરોક્ત મંજૂરી અનુસાર,તમે અહીં જણાવ્યા મુજબ, સુરક્ષા પૂરી પાડ્યા પછી ક્રેડિટસુવિધાઓનોલાભલીધોછેઅને તેનોઉપયોગકરવાનું શરૂ કર્યું છે.વિવિધલોન/ક્રેડિટસુવિધા ખાતાઓમાં વર્તમાન બાકો રકમઅને આવી જવાબદારી નાટે બનાવેલ સુરક્ષા હિતો નીચે મુજબ છે:

૦૫.૧૧.૨૦૨૫નારોજબાકી (કરારલેણાં) (૩૧.૧૦.૨૦૨૫સુધીનાવ્યાજસહિત

પ્રકાર પ્રકાર (રોકડ ક્રેડિટ. સ્ટોક- કમ-બુક દેવાં) 00511304000010	મવાકા રૂ. (લાખોમાં) 20.00 લાખ (રૂ. વીસ લાખ પુરા)	ખાજ કર મંજૂરી સમયે ૧૦.૦૦% (મંજૂરીની તારીખ ના રોજ) અસરકારક આરઓઆઈ ૯.૦૦%	૦૫.૧.૨૦૨૫નારાજ બાકી (કરારલણા) (૩૧.૧૦.૨૦૨૫ સુધીના વ્યાજ સાહત આજ સુધી ઓછી વસૂલાત) ૨૯.૦૨.૨૦૨૪ના રોજ બાકી રૂ.૨૦,૪૯,૫૩૬.૦૦ (એનપીએ તારીખ) ૦૧.૦૩.૨૦૨૪થી ૩૧.૧૦.૨૦૨૫ સુધી ૯.૦૦% ના દરે વ્યાજ રૂ.૪,૨૧,૫૮૩.૦૦ દંડ વ્યાજ (સરળ) ૦૧.૧૨.૨૦૨૪ થી ૦૧.૧૧.૨૦૨૫ સુધી ૨% ના દરેઃરૂ.૧૩,૫૮૨.૦૦ કુલ - રૂ.૧૨,૨૧,૩૫૫.૦૦ (કુલ રૂ. બારલાખ એકવી સહજારત્રણસો પંચાવન પુરા)
સુરક્ષા કરાર સિક્યોરિટીઝના સંક્ષિપ્ત વર્ણન સાથે.	એરિયા ધરાવે છે, જે : ચોરસ ફૂટ છે, જે : પરસ્પર નિશ્ચિત છે નં. ૩૨૭ અને જર્મ તાલુકા વેજલપુર ટાઉનશીપ, એસ.'	. E-૧ ૩૦૩ ધરાવતી નાલ્કની વિસ્તાર ૧ દ્રદ ૨૨.૦૦ ચોરસ મીટર , જે ૨૭૫૪ ચોરસ ફૂર Iન ધરાવતો સર્વે નંબર જિલ્લો અમદાવાદ, દી.(રેંગ રોડ પર સ્થિત	ા મિલકતનો તમામ ભાગ, જેમાં ૧૬૯૦ ચોરસ ફૂટ કાર્પેટ એરિયા છે, જે ૧પ૭ ચોરસ મીટર વોશ ૦ ચોરસ ફૂટ P છે, જે ૧પ.૦૦ ચોરસ મીટર જેટલો છે અને વધારાનો ખુલ્લો ટેરેસ વિસ્તાર ૨૪૦.૦૦ ૧ જેટલો છે. કોમન એરિયામાં શેર સાથે, સુપર બિલ્ટ-અપ એરિયા તરીકે ઓળખાતો કુલ વિસ્તાર ટ છે, જે ૨પ૬.૦૦ ચોરસ મીટર જેટલો છે. બ્લોક ને E માં ૧૩મા માળે "સોરેલ" ની યોજનામાં, સર્ ૨૩૨૫, ૩૨૬/૧,૩૨૬/૨,૩૨૮,૩૨૯,૩૩૦,૩૩૧/૧+૨,૩૪૪,૩૪૯ નો ભાગ મૌજે: સરમેજ, ઉપ-જિલ્લો અમદાવાદ-૪ (પાલડી), ફ્લેટ નં. E ૧૩૦૦૩, સોરેલ એપાર્ટમેન્ટ, એપલવુડ્સ ા છે. સરખેજ-સંથાલ-૩૮૦૦૫૮ (તે જજમીન/મકાન પર બનાવેલા/કરવાના બાંધકામ સાથે) અને દ્રપૂર્વતરક: ખુલ્લી જગ્યા, પશ્ચિમ તરફ: ફ્લેટ નં. ૧૩૦૪, ઉત્તર તરફ: ફ્લેટ નં. ૧૩૦૨, દક્ષિણ તરફ:

<u>મિલકતની માલિકી:- શ્રી સ્નેહ અનિલ ત્રિવેદી અને પૂજા સ્નેહ ત્રિવેદી</u> . ૧૦.૦૫.૨૦૨૩ના દેવાની સ્વીકૃતિ પત્રમાં, તમે ૦૪.૦૪.૨૦૨૩ના રોજ બેંક પ્રત્યેની તમારી જવાબદારી રૂ. ૧૯,૫૦,૦૦૦.૦૦ (કેશ ક્રેડિટ હાઇપો) સ્વીકારી છે.ઉપરોક્તબાકી રકમમાં ૩૧.૧૦.૨૦૨૫ સુધીના વધારાના ડ્રોઇંગ અને વ્યાજનો સમાવેશ થાય છે.

છે.જેમ તમે જાણો છો, રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના નિર્દેશો અનુસાર, જ્યારે ટર્મ લોનના સંદર્ભમાં વ્યાજ અને/અથવા મુદલ ૯૦ દિવસથી વધુ સમય માટે મુદતવીતી રહે છે,ત્યારે તે NPA બની જાય છે. અને ઓવરડ્રાસ્ટ/કશ ક્રેડિટ (OD/CC) ના સંદર્ભમાં ખાતું ૯૦ દિવસથી વધુ સમય માટે "આઉટ ઓફ ઓર્ડર" રહે છે. આવી સુવિધા NPA બની જાય છે. તમારું ઉપરોક્ત કેશ ક્રેડિટ ખાતું ૯૦ દિવસથી વધુ સમય માટે આઉટ ઓફ ઓર્ડર રહ્યું.

ે.તમારાદ્વારા કરવામાં આવેલા ડિફોલ્ટના પરિણામે, તમારા કેશ કેડિટ એકાઉન્ટને ૨૯.૦૦૨.૨૦૨૪ના રોજ ભારતીય રિઝર્વ બેંકના નિર્દેશો અને માર્ગદર્શિકા અનુસાર નોન-પર્ફોર્મિંગ એસેટતરીકે વર્ગીકૃત કરવામાં આવ્યું છે. અમારી વારંવારની વિનંતીઓ અને માંગણીઓ છતાં તમે વ્યાજ સહિત લોન ચૂકવી નથી. . ઉપરોક્ત ફકરા ૧ માં ઉલ્લેખિત વિવિધ સિક્યોરિટીઝ દ્વારા યોગ્ય રીતે સુરક્ષિત કરાયેલ ક્રેડિટ સુવિધાઓના સંદર્ભમાં તમારી જવાબદારીઓ પૂર્ણ કરવામાં તમારી

અસમર્થતાને ધ્યાનમાં રાખીને, અને તમારા ખાતાને નોન-પર્ફોર્મિંગ એસેંટ તરીકે વર્ગીકૃત કરવા માટે, અમે તમને સિક્યોરિટાઇઝેશન એન્ડ રિકન્સ્ટ્રક્શન ઓફ ફાઇનાન્શિયલ એસેટ્સ એન્ડ એન્ફોર્સમેન્ટ ઓફ સિક્યોરિટી ઇન્ટરેસ્ટ એક્ટ, ૨૦૦૨ ની કલમ ૧૩ની પેટા-કલમ (૨) હેઠળ સૂચના આપીએ છીએ, અને તમને અ સૂચનાની તારીખથી ૨૦ દિવસની અંદર ઉપરોક્ત કકરા ૧ માં જણાવ્યા મુજબ રૂ. ૧૨,૨૧,૩૫૫.૦૦ (કુલ રૂ. બાર લાખ એકવીસ હજાર ત્રણસો પંચાવન પુરા) ની સંપૂર્ણ ચુકવણી કરવા અને બેંકને તમારી જવાબદારીઓ પૂર્ણ કરવા માટે આહ્વાન કરીએ છીએ. અમે તમને વધુમાં સૂચના આપીએ છીએ કે ચુકવણીની તારીખ સુધી ઉપરોક્ત રકમ વ્યાજ સાથે ચૂકવવામાં નિષ્ફળ રહેવાથી, અમે ઉપરોક્ત કાયદાની કલમ ૧૩ ની પેટા-કલમ (૪) હેઠળના તમામ અથવા કોઈપણ અધિકારોને ઉપયોગ કરવા માટે સ્વતંત્ર રહીશું, જેની કૃપા કરીને નોંધ લો.

..કૂપા કરીને નોંધ લો કે, સંપૂર્ણ ચુકવણીન થાય ત્યાં સુધી દરેક ક્રેડિટ સુવિધા માટે ઉપરોક્તફકરા ૧ માં ઉલ્લેખિત દરે વ્યાજ વધતું રહેશે. . અમે તમારું ધ્યાન ઉપરોક્ત કાયદાની પેટા-કલમ ૧૩ તરફ ખેંચીએ છીએ જેના સંદર્ભમાં તમને ઉપરોક્ત ફકરા ૧ માં ઉલ્લેખિત કોઈપણ સુરક્ષિત સંપત્તિને વેચાણ

લીઝ અથવા અન્યથા (સામાન્ય વ્યવસાય સિવાય) અમારી પૂર્વ લેખિત સંમતિ મેળવ્યા વિના ટ્રાન્સફર કરવા પર પ્રતિબંધ છે. અમે ઉમેરી શકીએ છીએ કે ઉપરોક્ત કાયદાની કલમ ૧૩(૧૩) માં સમાવિષ્ટ ઉપરોક્ત જોગવાઈનું પાલન ન કરવું એ કાયદાની કલમ ૨૯ હેઠળ સજાપાત્ર ગુનો છે. . અમે તમારું ધ્યાન ઉપરોક્ત કાયદાની કલમ 13 ની પેટા કલમ (8) તરફ આકર્ષિત કરીએ છીએ જેના સંદર્ભમાં તમે સુરક્ષિત સંપત્તિઓ રિડીમ કરી શકો છો, જો બેંક

દ્વારા કરવામાં આવેલા બાકી રકમ, તમામ ખર્ચ, ચાર્જ અને ખર્ચાઓ સાથે, જાહેર હરાજી/આમંત્રિત ક્વોટેશન/ટેન્ડર/ખાનગી સંધિ માટે સૂચનાના પ્રકાશનની તારીખ પહેલાં કોઈપણ સમયે. કૂપા કરીને નોંધલો કે ઉપરોક્ત સૂચનાના પ્રકાશન પછી, સુરક્ષિત સંપત્તિઓ રિડીમ કરવાનો તમારો અધિકાર ઉપલબ્ધ રહેશે નહીં.

. કૃપા કરીને નોંધ લો કે આ માંગ સૂચના કોઈપણ અન્ય અધિકારો અથવા ઉપાયોના માફી તરીકે પૂર્વગ્રહ વિના છે અને તેનો અર્થઘટન કરવામાં આવશે નહીં જે અમારી પાસે હોઈ શકે છે, જેમાં મર્યાદા વિના, અમારા પર બાકી રકમના સંદર્ભમાં વધુ માંગણી કરવાનો એધિકાર શામેલ છે.

(સુરેશ એસ પટેલ) બધિકૃત અધિકારી. સહિતઃ ૧.એકાઉન્ટ સ્ટેટમેન્ટ અને ઇન્ટ. ગણતરી શીટ

adani Power

અદાણી પાવર લિમિટેડ

પોસ્ટલ બેલેટ નોટિસ

અદાણી પાવર લિમિટેડ ("**કંપની**") ના સભ્યોને આથી જાણ કરવામાં આવે છે કે કંપનીઝ એક્ટ ૨૦૧૩ (**"અદ્યિતિયમ**") ની ક્લમ ૧૧૦ અને ૧૦૮ ની જોગવાઈઓ અને કંપનીઓ (મેનેજમેન્ટ અને એડમિનિસ્ટ્રેશન) નિયમો , ૨૦૧૪ (**"નિયમો"**) ના નિયમો ૨૦ અને ૨૨ સાથે વાંચવામાં આવતી અન્ય તમામ લાગુ જોગવાઈઓ , જો કોઈ હોય તો, અનુસાર, ("MCA **પરિપત્રો**"), ઈન્સ્ટિટ્યુટ ઓફ કંપની સેક્રેટરીઝ ઓફ ઈન્ડિયા દ્વારા જારી કરવામાં આવેલ જનરલ મીટિંગ્સ પર સેક્રેટરીચલ સ્ટાન્ડર્ડ (**"SS-ર**") અને SEBI (લિસ્ટિંગ ઓબ્લિગેશન્સ એન્ડ ડિસ્ક્લોઝર રિક્વાયરમેન્ટ્સ) રેગ્યુલેશન્સ, ૨૦૧૫ ("SEBI લિસ્ટિંગ રેગ્યુલેશન્સ") ના નિયમન ૪૪, હાલમાં અમલમાં ૨હેલા કોઈપણ કાયદાકીય સુધારા(ઓ), રિપ્લેસમેન્ટ(ઓ) અથવા પુન:અધિનિયમ(ઓ) અને મીનીસ્ટ્રી ઓફ કોર્પોરેટ અફેચર્સ ("MCA") દ્વારા ભરી કરાચેલ ૧૯ સપ્ટેમ્બર ૨૦૨૪ ના રોજના સામાન્ય પરિપત્ર, આ સંદર્ભમાં સમચાંતરે જારી કરાચેલ અન્ય સંબંધિત પરિપત્રો ("**MCA પરિપત્રો**") અને કોઈપણ અન્ય લાગુ કાચદા, નિયમો અને વિનિયમો (કોઈપણ વૈદ્યાનિક ફેરફાર સહિત અથવા તેના પુન:અદિનિયમ(ઓ) , કે જે હાલના સમય માટે અમલમાં છે) તે અનુસાર કંપની પોસ્ટલ બેલેટ નોટિસ તારીખ ૨૧મી નવેમ્બર, ૨૦૨૫ ના રોજ પોસ્ટલ બેલેટ નોટિસમાં સ્પષ્ટીકરણાત્મક નિવેદન (**"નોટિસ"**) સાથે દર્શાવ્યા મુજબ, ફક્ત ઇલેક્ટ્રોનિક માધ્યમો (એટલે કે રિમોટ ઈ-વોટિંગ) દ્વારા જરૂરી ઠરાવો દ્વારા ખાસ વ્યવસાય માટે સભ્યોની મંજૂરી માંગે છે.

પોસ્ટલ બેલેટ નોટિસ (**"નોટિસ**") ની ઇલેક્ટ્રોનિક નક્લો સ્પષ્ટીકરણ નિવેદન સાથે ગુરૂવાર, તારીખ ૨૭મી નવેમ્બર, ૨૦૨૫ ના રોજ તે સભ્યોને મોકલવામાં આવી છે કે જેમના નામ નેશનલ સિક્ચોરિટીઝ ડિપોઝિટરી લિમિટેડ ("**NSDL**") અને સેન્ટ્રલ ડિપોઝિટરી સર્વિસિસ (ઇન્ડિયા) લિમિટેડ ("**CDSL**") માંથી પ્રાપ્ત થયેલા સભ્યોના ૨જિસ્ટર / લાભદાયી માલિકોની સૂચિ પર શુક્રવાર, તારીખ ૨૧મી નવેમ્બર, ૨૦૨૫ (**"કટ-ઓફ તારીખ**") ના રોજ દેખાય છે અને જેમણે કંપની/ડિપોઝિટરીઝ સાથે તેમના ઈ-મેલ સરનામાં રજીસ્ટર કર્યા છે. પોસ્ટલ બેલેટ નોટિસની ભૌતિક નકલો પોસ્ટલ બેલેટ ફોર્મ્સ અને પ્રી-પેઇડ બિઝનેસ રિપ્લાય એન્વલપ્સ આ પોસ્ટલ બેલેટ માટે સભ્યોને એમસીએ પરિપત્રોમાં આપવામાં આવેલી મુક્તિને અનુરૂપ મોકલવામાં આવી રહી નથી.પોસ્ટલ બેલેટ નોટિસમાં ઉલ્લેખિત દસ્તાવેજો નિરીક્ષણ માટે ઉપલબ્ધ છે અને નિરીક્ષણ કરવા માંગતા સભ્યો deepak.pandya@adani.com પર ઇમેઇલ મોક્લી શકે છે.

નોટિસ કંપનીની વેબસાઇટ એટલે કે <u>www.adanipower.com</u> અને સ્ટોક એક્સચેન્જની વેબસાઇટ એટલે કે બીએસઈ લિમિટેડ અને નેશનલ સ્ટોક એક્સરોન્જ ઓફ ઇન્ડિયા લિમિટેડની વેબસાઇટ અનુક્રમે www.bseindia.com અને www.nseindia.com પર અને CDSLની વેબસાઇટ એટલે કે www.evotingindia.com પર ઉપલબ્ધ છે.

શેરધારકો કે જેમણે તેમના ઈ-મેલ એડેસની નોંધણી કરાવી નથી અને પરિણામે ઈ-વોટિંગ નોટિસ મેળવી શક્યા નથી, તેઓ કંપનીના આરટીએ સાથે તેમનું ઈ-મેલ એડ્રેસ રજસ્ટર કરાવી શકે છે. શેરધારકો આરટીએની વેબસાઈટ <u>https://karisma.kfintech.com/emailreg</u>. પર જઈ શકે છે અને ઈન્વેસ્ટર સર્વિસ ટેબમાં ઈ-મેલ રજ્ઞસ્ટ્રેશન હેડિંગ પર ક્લિક કરી અને તેમાં માર્ગદર્શન મુજબ નોંધણી પ્રક્રિયાને અનુસરી ઈ-મેલ એડ્રેસ રજ્સ્ટર કરાવી શકે છે. કોઈપણ પ્રશ્નના કિસ્સામાં , સભ્ય આરટીએને <u>einward.ris@kfintech.com</u> પર ઈ-મેલ મોકલી શકે છે.

સેન્ટ્રલ ડિપોઝિટરી સર્વિસીસ (ઇન્ડીયા) લિમિટેડ (**"સીડીએસએલ**") દ્વારા પૂરી પાડવામાં આવતી ઇ-વોટિંગ સેવાઓ દ્વારા ઈલેક્ટ્રોનિક માધ્યમથી સભ્યોને તેમના મત આપવાના અધિકારનો ઉપયોગ કરવાની સુવિધા પૂરી પાડે છે. નોટિસમાં ઈ-વોટિંગ માટેની વિગતવાર સૂચનાઓ આપવામાં આવી છે.

રિમોટ ઈ-વોટિંગ સવિદ્યા નીચેના સમયગાળા દરમિયાન ઉપલબ્ધ છે:

ઇ-વોટિંગની શરૂઆત શનિવાર, રલ્મી નવેમ્બર, ૨૦૨૫ના રોજ સવારે ૯:૦૦ કલાકે (IST) ઇ-વોટિંગનું સમાપન રવિવાર, ર૮મી ડીસેમ્બર, ૨૦૨૫ના રોજ સાંજે ૫:૦૦ કલાકે (IST)

સીડીએસએલ દ્વારા રિમોટ ઈ-વોટિંગ મોડ્યુલ ત્યાર બાદ મતદાન માટે અક્ષમ કરવામાં આવશે .

આ સમયગાળા દરમિયાન, શૂકવાર, તારીખ ૨૧મી નવેમ્બર, ૨૦૨૫ (**"કટ-ઓફ તારીખ"**) ના રોજ ભૌતિક સ્વરૂપમાં અથવા ડીમટીરિચલાઈઝ્ડ સ્વરૂપમાં શેર ધરાવતા સભ્યો ઈ-વોટિંગ દ્વારા તેમનો મત આપી શકે છે. એકવાર સભ્ય દ્વારા ઠરાવ પર મત આપવામાં આવે, તે પછીથી તેને બદલવાની મંજૂરી નથી. સભ્યોના મતદાન અધિકારો કટ-ઓફ તારીખ એટલે કે શુક્રવાર, તારીખ ૨૧મી નવેમ્બર, ૨૦૨૫ ના રોજ કંપનીની પેઇડ-અપ ઇક્વિટી શેર મૂડીના તેમના હિસ્સાના પ્રમાણમાં હશે . જે વ્યક્તિ કટ-ઓફ તારીખ ના રોજ સભ્ય નથી , તેઓએ આ સૂચનાને માત્ર માહિતીના હેતુ માટે જ ગણવી.

કંપનીના બોર્ડ ઓફ ડિરેક્ટર્સે શ્રી ચિરાગ શાહની (સદસ્ય નંબર. FCS: ૫૫૪૫; CP નં.: ૩૪૯૮), અથવા તેમની અવેજીમાં શ્રી રાયમીન મરડીયા (સદસ્ય નંબર: FCS: ૧૧૨૮૩; CP નં.: ૧૭૫૫૪) કે જે કંપની સેક્રેટરીની પ્રેક્ટિસ કરે છે, તેઓની નિષ્પક્ષ અને પારદર્શક રીતે પોસ્ટલ બેલેટ પ્રક્રિયા હાથ ધરવા માટે સ્ક્રુટિનાઈઝર તરીકે નિમણૂક કરી છે.

સ્ક્રુટિનાઈઝર તેમનો રિપોર્ટ કંપનીના ચેરમેન અથવા કંપની સેક્રેટરીને અથવા કોઇપણ અધિકૃત વ્યક્તિને સુપરત કરશે અને પોસ્ટલ બેલેટના પરિણામો ઈ-વો ટિંગના સમાપનથી ૨ કામકાજના દિવસોમાં જાહેર કરવામાં આવશે . આ પરિણામો કંપનીના રુજિસ્ટર્ડ ઓફિસમાં પ્રદર્શિત કરવામાં આવશે અને તેને નેશનલ સ્ટોક એક્સચેન્જ ઓફ ઈન્ડિયા લિમિટેડ અને બીએસઈ લિમિટેડની વેબસાઇટ પર પણ અપલોડ કરવામાં આવશે. વધુમાં, પરિણામો કંપનીની વેબસાઇટ <u>www.adanipower.com</u> અને CDSL ની વેબસાઇટ <u>www.evotingindia.com</u> પર પણ અપલોડ કરવામાં આવશે. ઈ-વોટિંગ સંબંધી કોઈપણ પ્રશ્નો હોય, તો સભ્યો તે માટે <u>www.evotingindia.com</u> ઉપર હેલ્પ સેક્શનમાં (ફ્રીક્વન્ટલી આસ્કડ કવેશ્ચન્સ - **"FAQs"** (અવારનવાર પુછાતા પ્રશ્નો) અને ઈ-વોટિંગ મેન્યુઅલ નો ઉપયોગ કરી શકે છે અથવા <u>helpdesk.evoting@cdslindia.com</u> પર ઈ-મેઈલ કરી શકે છે અથવા નંબરઃ ૦૨૨-૨૩૦૫૮૫૪૨/૪૩ પર ફોન કરીને જાણકારી મેળવી શકે છે. ઈ-વોટિંગને લગતી કોઈ પણ ફરિચાદ હોય તો, શ્રી રાકેશ દલવી, સિનિચર મેનેજર, સેન્ટ્રલ ડિપોઝિટરી સર્વિસીસ (ઇન્ડિયા) લિમિટેડ, એ વિન્ગ, રપમો માળ, મેરેથોન ફ્યુચુરેક્ષ, મફ્તલાલ મિલ્સ કમ્પાઉન્ડ, એન એમ જોશી માર્ગ, લોઅર પરેલ (પૂર્વ), મુંબઈ - ૪૦૦ ૦૧૩ નો સંપર્ક ઈ-મેઈલ : <u>helpdesk.evoting@cdslindia.com</u> પર અથવા ઉપરોક્ત ટોલ ફ્રીનંબર ઉપર કરી શકાશે .

અદાણી પાવર લિમિટેડ વતી,

દિપક એસ પંડ્યા કંપની સેક્રેટરી

૨જીસ્ટર્ડ ઓફિસ: "અદાણી કોર્પોરેટ હાઉસ", શાંતિગ્રામ, વૈષ્ણોદેવી સર્કલ પાસે, એસ. જી. હાઈવે, ખોડિયાર, અમદાવાદ - ૩૮૨૪૨૧, ગુજરાત, ભારત.

होन नं.: +eq-9e-२५५५ 9५५५ | ईंड्स नं.: +eq-9e-२५५५ 9q99

તારીખઃ ૨૭મી નવેમ્બ૨, ૨૦૨૫

સ્થળઃ અમદાવાદ

Neeraja Karandikar

Company Secretary

વેબસાઇટ: <u>www.adanipower.com</u> | સી.આઇ.એન .: L40100GJ1996PLC030533

જ્યાવાનું કે નીચે સહીં કરનારે એસઆરજી લાઉસિંગ કાચાનન લીમીટેડ, રરવ, એસએમ લોઢા કોમ્પલેક્ષ, શાની સર્કલ પાસે, ઉદેપુર 393,00 (રાજશાનન) (CIN. 165922R.1999PLC01544) ના પ્રાદિક્ત પ્રાદિક્ત કરીની રૂએ સર્દર્શની એક્ટ, ૨૦૦૨ હેલા અને સિક્સોરીની ક્રેપ્ટ સર્દર્શની એક્ટ, ૨૦૦૨ હેલા અને સિક્સોરીની ક્રેપ્ટ સર્દર્શની એક્ટ, ૨૦૦૨ હેલા અને સિક્સોરીની કર્યર ૧૩(૧૨) હેલા ગીરો મિલકતોનો ભૌતિક કબજો લાં લીધો છે અને તેની માહીતી 'ફાચનાન્સિયલ એક્સપ્રેસ, ગુજરાતી' માં ગુજરાતી ભાષામાં ૨૭, ૧૧,૨૦૨૫ના રોજ પ્રસિદ્ધ કરાક હતી. બેમાં લોન એકાઉલ્ટ નં. HLR0000000003877, HLR0000000000017689 HLR00000000003720, HLR00000000017669 HLR00000000007252, HLR00000000016489

તારીખઃ૦૫.૧૧.૨૦૨૫

સ્થળઃ ગુજરાત ફાચનાન્સ લીમીટેડ, ઉદેપુ પ્રકાશનની તારીખ : ૨૮.૧૧.૨૦૨૪

ILR0000000000372015790 HLR000000000014227 માં સાંકેતિક કબજો લખાચેલ હતો જે હવે ભવિષ્યિમાં ભૌતિક કબજો વાંચવાનો અને સમજવાનો રહેશે. અધિકૃત અધિકાર્



NOT	ICE INVITING TE	ENDERS	Nov 28, 2025
TATA Power-DDL invites tende	ers as per following de	etails:	
Tender Enquiry No. Work Description	Estimated Cost/EMD (Rs.)	Availability of Bid Document	Last Date & Time of Bid Submission/ Date and time of Opening of bids
TPDDL/PMG/Tender/Power/ Purchase-2025-26/02 Notice Inviting bids for procurement of Up to 300 MW RTC/Slot wise power under Short Term arrangement for the period from 16.05.2026 to 30.06.2026.	As per Guidelines for short term procurement of power notified by the Ministry of power as amended time to time.	28.11.2025	17.12.2025;1300 Hrs. 17.12.2025;1330 Hrs
Complete tender and corrigend	lum document is availa	able on our	

Chola

ચોલામંડલમ ઈન્વેસ્ટમેન્ટ એન્ડ ફાઈનાન્સ કંપની લિમીટેડ કોર્પોરેટ ઓફિસ : ચોલા કેસ્ટ સી-પ૪ અને ૫૫, સુપર બી-૪ થીર વી કા ઇન્ડસ્ટ્રીચલ અસ્ટટ, ગુડા, વન્નાઇ-૩૬૦૦૦ શાખા ઓફિસ : શાખા ઓફિસ : ૪૦૬ થી ૪૧૦, ૪થો માળ, "દી વન વર્લ્ડ", સીનર્જી હોસ્પિટલની સામે, અચોધ્યા ચોક પાર ૧૫૦ ફીટ રીંગ રોડ,રાજકોટ-૩૬૦૦૦૫. સંપર્ક નં.: શ્રી પ્રેમલ ભટ્ટ : ૯૩૭૬૧૫૨૫૮ અને શ્રી પ્રિતેશ ઓઝા : ૯૪૨૪૪૫૬૬૧

website www.tatapower-ddl.com→Vendor Zone → Tender / Corrigendum Documents

સ્થાવર મિલકતના વેચાણ માટે વેચાણ નોટીસ

સિક્ચોરીટી ઇન્ટરેસ્ટ (એન્ફોર્સમેન્ટ) નિયમો, ૨૦૦૨ના નિયમ ૮ અને ૯ ની જોગવાઇ સાથે વંચાતા સિક્ચોરીટાઇગ્રેશ એન્ડ રિકન્સ્ટ્રકશન ઓફ ફાઈનાન્સિ એસેટ્સ એન્ડ એન્ફોર્સમેન્ટ ઓફ સિક્ચોરીટી ઇન્ટરેસ્ટ કાયદા, ૨૦૦૨ હેઠળ સ્થાવર મિલકતોના વેચાણ માટે ઇ-હરાજી વેચાણ નોટીસ.

આથી ખાસ કરીને દેવાદાર/સહ-દેવાદાર/ગીરવેદાર(રો) અને જાહેર જનાનો નોટીસ આપવામાં આવે છે કે નીચે વર્ણવેલી સ્થાવર મિલકતો જે સિક્ચોર્ડ કોડિટરને ગીરો કરાયેલ છે, તેનો **પ્રત્યક્ષ કબજે** ચોલામંડલમ ઈન્વેસ્ટમેન્ટ એન્ડ ફાઈનાન્સ કંપની લિમિટેડ જે અહીં હવે ચોલામંડલમ ઈન્વેસ્ટમેન્ટ એન્ડ ફાઈનાન્સ કંપની લિમિટેડ તરીકે સંદર્ભીત છે તેના અધિકૃત અધિકારીએ લઈ લીધો છે. સુરક્ષિત મિલકતો **જ્યાં છે ત્યાં, જે છે તે અને જેમ છે તેમના ધોરણે** ઇ-હરાજી મારફતે વેચવામાં આવશે.

ખાતા નં. અને દેવાદાર	ડિમાંડ નોટીસ મુજબ	મિલક્ત/તો નું વર્ણન	રીઝર્વ કિંમત અને	હરાજીની તારીખ અને સમય,
સહ-દેવાદાર,	કલમ ૧૩(૨) હેઠળ		ઈએમડી અને બીડ	ઈએમડી જમા કરાવવાની છેર્લ્લ
ગીરવેદારના નામ	તારીખ અને ૨કમ		વૃદ્ધિની સ્કમ (રૂા. માં)	તારીખ નિરીક્ષણની તારીખ
HE01VDP00000094775 & HE01VDP00000094755 & પ્રોક્રિયાર જમાલાદાસ મેદ્યારા, નેહલંબેન હેપ્પીલાઇ મેદ્યારા અને એલાઇટ એસોસિએટ્સ બધાના સંપર્ક માટે સરનામાં રાધિકા હાઇટ્સ એ ૭૦૧, ખોડિચાર હોટેલ પાછળ, કંબી રેસ્ટોચર નજીક, કંગાશીચાળી, રાજકોટ ગુજરાત ૩૬૦૦૨૨ અન્ય સરનામું: પ્લોટ નં. ૧૬, સબ પ્લોટ નં. ૧૬,મે, પંચશીલ સોસાચટી, દોશી હોસ્પિટલ નજીક, સિન્ને પોલિક પાછળ, ગોંડલ રોડની બહાર, રાજકોટ ૩૬૦૦૦૪	08/07/2025 અને રૂ1.1,29,38,016/- તા. 08-07-2025 મુજબ	મિલકત નં. ૧:- સ્થાવર રહેણાંક મિલકતના તે બધા ભાગ અને પાર્સલ ખુલ્લી જમીન હોવાથી ક્ષેત્રફળ ૧૫૪-૫૮ ચો. મી. સિટી સર્વ વોર્ડ નં. ૭ ના પ્લોટ નં. ૧૬/એ અને રેવન્થુ સર્વ નં. ૩૮૨/૧ ના સિટી સર્વ નં. ૧૬/એ અને રેવન્થુ સર્વ નં. ૩૮૨/૧ ના સિટી સર્વ નં. ૧૬૦૯ પૈકી ગુજરાત રાજ્યમાં રાજકોટ, તા. અને જિલ્લો: રાજકોટ ખાતે સ્થિત છે. જેની ચતુ:સીમાઓ નીચે મુજબ છે:- ઉત્તરઃ- ૩૦.૦૦ ફૂટ પહોળો રોડ, દિસાય:- પ્લોટ નં. ૧૧, પૂર્વઃ- પ્લોટ નં. ૧૬/બી, પશ્ચિમ:- ૩૦.૦૦ ફૂટ પહોળો રોડ. મિલકત નાં. ૧:- સ્થાવર રહેણાંક મિલકતના તે બધા ભાગ અને પાર્સલ ખુલ્લી જમીન હોવાથી ક્ષેત્રફળ ૧૫૪-૫૮ ચો. મી. સિટી સર્વ વોર્ડ નં. ૭ ના પ્લોટ નં. ૧૬/ની અને રેવન્થુ સર્વે નં. ૩૮૨/૧ ના સિટી સર્વે નં. ૧૬/બી અને રેવન્થુ સર્વે નં. ૩૮૨/૧ ના સિટી સર્વે નં. ૧૬/બી અને રેવન્થુ સર્વે નં. ૩૮૨/૧ ના સિટી સર્વે નં. ૧૬/૦૫ ના પોટ નં. ૧૪૬ કોર, તા. અને જિલ્લો: રાજકોટ ખાતે ગુજરાત રાજ્યમાં સ્થિત છે. સીમાઓ નીચે મુજબ છે:- ઉત્તરઃ- ૩૦.૦૦ ફૂટ પહોળો રોડ, દક્ષિણ:- પ્લોટ નં. ૧૫, પૂર્વઃ- પ્લોટ નં. ૧૬/સી, પશ્ચિમ:- પ્લોટ નં. ૧૬/એ.	ਸਿલકલ ਗੰ. ੧ ਸਾਣੇ ੩1. 75,00,000 /- ੩1. 7,50,000/- ੩1. 1,00,000/- ਸ਼ਰਤਗ ਗੰ. ੨ ਸਾਣੇ ੩1. 75,00,000 /- ੩1. 7,50,000/- ੩1. 1,00,000/-	૧૬-૧૨-૨૦૨૫ ના રો સવારે ૧૧.૦૦ શી બપોરે ૧.૦૦ શુધી (૩ મિલિટના અમચાદિત વધારા સાથે) ૧૫-૧૨-૨૦૨૫ (સાંજે ૫.૩૦ શુધી) ૦૬-૧૨-૨૦૨૫ (સવારે ૧૧.૦૦ શી બપોરે ૧.૦૦ શુધી)

notices. ની મુલાકાત લેવાની વિનંતી કરવામાં આવે છે. પ્રસ્તાવિત બીડરો ઇ-હરાજીની વિગતો, મદદ, પ્રક્રિયા અને ઓનલાઈન તાલીમ માટે મે. ઓક્શ ફોક્સ પ્રાઇવેટ લિમિટેડ નો સંપર્ક કરી શકે છે. સંપર્ક પ્રાચી ત્રિવેદી સંપર્ક નંબરઃ ૯૦૧૬૬૪૧૮૪૮, ઇમેઇલ આઇડીઃ supporrt@auctionfocus.in અને શ્રં મુહમ્મદ રહીશ - ૮૧૨૪૦૦૦૦૩૦ / ૬૩७૪૮૪૫૬૧૬. ઇમેઇલ આઇડી: CholaAuctionLAP@chola.murugappa.com ઇ-હરાજીમાં ભાગ લેવા માટે નિચમો અને શરતોની વધુ વિગતો માટે કૃપા કરી https://www.auctionfocus.in/chola-lap

https://cholamandalam.com/news/ auction-notices. କୀ મુલાકાત લેશો આ સિક્ચોરીટી ઈન્ટરેસ્ટ (એન્ફોર્સમેન્ટ) નિયમો, ૨૦૦૨ ના નિયમ ૮ અને ૯ હેઠળની ૧૫ દિવસીય યૈધાનિક વેચાણ નોટીસ પણ છે.

<u>तारीण : २७.९१, २०२५, २४०१ : राषडोट (નોંध : વિવાદની સ્થિતીમાં આ નોટીસનો અંગ્રેજી અનુવાદ માન્ય ગણાશે.) સહી/- અધિકારી, ચોલામંડલમ ઇન્વેસ્ટમેન્ટ ફાયનાન્સ કંપની લિમિટેડ</u>

Chola

ચોલામંડલમ ઈન્વેસ્ટમેન્ટ એન્ડ ફાઈનાન્સ કંપની લિમીટેડ કોર્પોરેટ ઓફિસ : ચોલા કેસ્ટ સી-પ૪ અને ૫૫, સુપર બી-૪,થીર વી કા ઇન્ડસ્ટ્રીચલ એસ્ટેટ, ગુંડી, ચેન્નાઇ-૩૬૧ શામાં ઓફિસ : શામાં ઓફિસ : ૪૦૬ થી ૪૧૦, ૪થો માળ, "ધી વન વર્લ", સીનર્જી હોસ્ટિસ્ટલની સાંગ, અચોધ્યા ચોક આ દી નોંધ કે ક્યાર કાર્યું કે કહ્યું કે હો સામ હોયા કે કાર્યું કે કરો હોય હોય કે કોર્યું કે કોર્યું કે હોય હોય ક स्थावर भिલકतना वेचाए। माटे वेचाए। नोटीस

સિક્ચોરીટી ઇન્ટરેસ્ટ (એન્ફ)સેમેન્ટ) નિયમો, ૨૦૦૨ના નિયમ ૮ અને ૯ ની જોગવાઈ સાથે વંચાતા સિક્ચોરીટાઈગ્રેશ એન્ડ રિકન્સ્ટ્રકશન ઓફ ફાઈનાન્ટિ એસેટ્સ એન્ડ એન્ફોર્સમેન્ટ ઓફ સિક્ચોરીટી ઈન્ટરેસ્ટ કાયદા, ૨૦૦૨ હેઠળ સ્થાવર મિલકતોના વેચાણ માટે ઇ-હરાજી વેચાણ નોટીસ આથી ખાસ કરીને દેવાદાર/સહ-દેવાદાર/ગીરવેદાર(રો) અને જાહેર જનાતાને નોટીસ આપવામાં આવો છે કે નીચે તે વધાવ મહિતાને છે, તેનો **સાંકેલિક કબજો** ચોવામંડલમ ઇન્વેસ્ટમેન્ટ એન્ડ કાઇનાન્સ કંપની લિમિટેડ જે અહીં હવે ચોવામંડલમ ઇન્વેસ્ટમેન્ટ એન્ડ ફાઇનાન્સ કંપની લિમિટેડ તરીકે સંદર્ભીત છે તેના અધિકૃત અધિકારીએ લઇ લીધો છે. સુરક્ષિત મિલકતો **જ્યાં છે ત્યાં, જે છે તે અને જેમ છે તેમના ધોરણે** ઇ-હરાજી મારફતે વેચવામાં આવશે.

આથી જાહેર જનતાને જણાવવામાં આવે છે કે અમે જાહેર ઇ-હરાજી વેબસાઈટ https://www.auctionfocus.in/chola-lap. મારફતે કરી રહ્યા છીએ

ખાતા નં. અને દેવાદાર સહ-દેવાદાર, ગીરવેદારના નામ	ડિમાંડ નોટીસ મુજબ કલમ ૧૩(૨) હેઠળ તારીખ અને રકમ	ਮਿલકत/तो ਗੁਂ વर्शन	રીઝર્વ કિંમત અને ઈએમડી અને બીડ વૃદ્ધિની રકમ (રૂા. માં)	હરાજીની તારીખ અને સમય, ઈએમડી જમા કરાવવાની છેલ્લી તારીખ
Loan A/c No. ML01PPY00000082124 અંજના શાંતિલાલ જુંગી, શાંતિલાલ ગોલિંદ જુંગીવાલા, ઉત્સવ શાંતિલાલ જુંગી બધા પાસે પત્રવ્યવહારનું સરનામું છે પદમણી ફુપા, હજીર પેલેસ સામે, જુરીબાગ વિસ્તાર, પોરબંદર-૩૬૦૫૭૫. અન્ય સરનામું: જુરીબાગ વિસ્તાર, વિભાગ બી- મા એવેલ જમીના, ભાગ-બી, મ્યુનિ. મિલકત નં.૧૧-૧-૧૩૮૯/૧/૨, ચોપાટી ચોક પાસે, ઉત્તરા રોક, કોમશિંચલ, સી.એસ. નં. ૩૪૮૧ પૈકી, સી.એસ. વોર્ડ નં. ૩, પોરબંદર, ગુજરાત - ૩૬૦૫૭૫	06/08/2025 અનો રૂા. 28,38,881/- તા. 06-08-2025 મુજબ	રહેણાંક ઘરનું ફુલ બિલ્ટઅપ એરીયા ૩૨.૩૪ ચો.મી. જમીન પરનું બાંધકામ ૮૫.૪૫.૬૮ ચો.મી. ભાગ-બી, સી.એસ. બ્લોક નં.૩, સી.એસ. નં. ૩૪૮૧ પેકી મોજે ઝુરીબાગ એ રીયા જે પારે ૨૦૫૬ દ મ્યુનિસિપાલિટીની હૃદમાં આવેલ તાલુકો અને જીલ્લો પોરબંદર છે. જેની ચતુર્સીમાં નીચે મુજબ છે. પૂર્વ: અન્થ લોકોની મિલકત, ઉત્તર અન્થ લોકોની મિલકત, ઉત્તર અંગ્લ હોકોની મિલકત, ઉત્તર અંગ્લ હોકોની મિલકત, હતામાં અંગ્લ હોકોની મિલકત, હતામાં અંગ્લ હોકોની મિલકત, હતામાં અંગ્લ હતામાં અંગલ હતામ	য়া. 36,35,200/- য়া. 3,63,520/- য়া. 1,00,000/-	૩૧-૧૨-૨૦૨૫ ના રોજ સવારે ૧૧.૦૦ થી બપોરે ૧.૦૦ સુધી (૩ મિલિટના અમચાદિત વધારા સાથે) ૩૦-૧૨-૨૦૨૫ (સાંજે ૫.૩૦ સુધી)
Loan A/c No. ML01RTH00000077415 દિપક કાનજીભાઇ સોલંકી, વિનોદ કાનજી સોલંકી, રામીબેન સોલંકી, રામીબેન સોલંકી, રામાં સે પ્રત્યાલ કર્મા કે સરનામું છે કુપ્શનગર સોસાચટી, બીમરાણા, દેવભૂમિ હારકા, જી.: જામનગર, ગુજરાત-359.3૪૫ અન્ય સરનામું : લોટ નં. ૫૮ થી 5૨,૦,૦, ગામ- બીમરાણા, મધ્ય, આર. એસ. નં. ૪૦/૧ અને ૪૦/૨, તાલુકો: ઓખામંડલ, પેટા જિલ્લો કલ્યાણપુર, જિ.: જામનગર, રિલાચન્સ પેટ્રોલ પંપ સામે, ઓખા હાઇ રોડ, ગુજરાત 3593.3૫.	06/08/2025 અને રા. 39,89,849/- તા.06/08/2025 મુજબ	સ્થાવર મિલકતનો પ્લોટ નં. પટની જમીનું ક્ષેત્રફળ રદ્દદ્ કરા શે. મે. પ્લોટ નં. પટ, જમીન ક્ષેત્રફળ રદ્દ કરા શે. મે. પ્લોટ નં. પદ, જમીન ક્ષેત્રફળ રદ્દ કરા શે. મે. પ્લોટ નં. દ્રશ્ની જમીનનું ક્ષેત્રફળ રવડ ઘો. મે., પ્લોટ નં. દ્રશ્ની જમીનનું ક્ષેત્રફળ રવડ ઘો. મે. ફરની જમીનનું ક્ષેત્રફળ રવડ ઘો. મે. જે ભીમરાના રેવન્યુ સર્વે નં. ૪૦/૧ પૈકી જે મોજે ગામ : ભીમરાના, તાલુકો ઢારકા અને છુલ્લો દેવભૂમિ દ્ધારકા સાથે ભીમરાના ગ્રામ પંચાયતની હદમાં આવેલ છે. જે રમીબેન કાનજીભાઇ સોલંકીની છે. જેની યતુર્સીમા નીચે મુજબ છે. ઉત્તર: આ બાજુનો રોડ, દક્ષિણ: આ બાજુનો રસ્તો, પૂર્વ: આ બાજુનો રસ્તા, પશ્ચિમ: આ બાજુનો કોમન પ્લોટ.	য়া. 50,26,750/- য়া. 5,02,675/- য়া. 1,00,000/-	3૧-૧૨-૨૦૨૫ ના રોજ સવારે ૧.૦૦ થી બપોરે ૧.૦૦ સુધી (3 મિલિટના અમચાદિત વધારા સાથે) 3૦-૧૨-૨૦૨૫ (સાંજે ૫.૩૦ સુધી)

તમામ સહભાગીઓ/બીડર્સને વેબસાઈટ https://www.auctionfocus.in/chola-lap અને https://cholamandalam.com/news/auction notices. ની મુલાકાત લેવાની વિનંતી કરવામાં આવે છે. પ્રસ્તાવિત બીડરો ઇ-હરાજીની વિગતો, મદદ, પ્રક્રિયા અને ઓનલાઈન તાલીમ માટે મે. ઓક્શ કોક્સ પ્રાદિવેટ લિમિટેડ નો સંપર્ક કરી શકે છે. સંપર્ક પ્રાચી બિવેદી સંપર્ક નંબર: ૯૦૧૬૬૪૧૮૪૮. દામેઇલ આઇડી: Support@auctionfocus.in અને શ્રી મહમ્મદ રહીશ - ૮૧૨૪૦૦૦૦૩૦ / ၄૩७૪૮૪૫૬૧૬. ઇમેઇલ આઇડીઃ CholaAuctionLAP@chola.murugappa.com.

ઇ-હરાજીમાં ભાગ લેવા માટે નિયમો અને શરતોની વધુ વિગતો માટે કૃપા કરી https://www.auctionfocus.in/chola-lap https://cholamandalam.com/news/ auction-notices. ની મુલાકાત લેશો

આ સિક્યોરીટી ઇન્ટરેસ્ટ (એન્ફોર્સમેન્ટ) નિયમો, ૨૦૦૨ ના નિયમ ૮ અને ૯ હેઠળની ૩૦ દિવસીય વૈદ્યાનિક વેચાણ નોટીસ પણ છે. तारीण : २७.९१, २२१५ , २४११ : पोरतंहरा/प्रामनभर (तोंध : विवाहनी खितीमां आ नोहीसनी अंभेलु अनुवाह मान्य ग्राहाशी,**सही/- अधिदृत अधिद्वारी, योदामंऽदाम प्र**न्देस्ट्रेमेळ द्वायानस्य इंपनी विमिट्टे

यूनियन बैंक 🕠 Union Bank

રીજનલ ઓફિસ : યુનિયન બેંક ભવન બીજો માળ, કાલા ઘોડા સર્કલ પાસે, સચાજીગંજ, વડોદરા,

ગુજરાત. ફોનઃ ૦૨૬૫-૨૨૨૫૨૮૬

સ્થાવર મિલકતોના વેચાણ માટે ઈ-હરાજી નોટીસ

જાહેર જુનતાને અને ખાસ કરીને દેવાદાર(રો.) અને જામીનદાર(રો.)ને નોટીસ આપવામાં આવે છે કે નીચે જણાવેલ સ્થાવર મિલક્ત જાહિર વેપાણા એમ ખાતે કરણ વ્યાસન્દર્શ અને નામાનાદાર શુંગ નામાના આવતા આવતા કર્યા છે. કે વાર્ય સાવાય સ્વાસન માનાડન સિક્સાર્ડ લેઇશરએ ગીરો/રાર્જ કરાયેલ છે, જેનો **પ્રત્યક્ષ / સાંકેતિક કલખો યુનિયન બેંક એફ ઈન્ડિયા** (સિક્સોર્ડ લેઇશર)ના અધિકૃત અધિકારીએ લઇ લીધો છે, **તે "જ્યાં છે ત્યાં", "જે છે તે" અને "ત્યાં જે કાંઇ છે તે" ના ઘોરણે <mark>યુનિયન બેંક એફ</mark> ઇન્ડિયાની** નીચે જણાવેલા દેવાદાર(રો) અને જામીનદાર(રો) પાસેથી નીચે જણાવેલી રકમની વ્યાજ અને અન્ય ખર્ચા સહિતની વસુલાત

માટે વેચાણ કરવામાં આવશે. રિઝર્વે કિંમત અને અર્નેસ્ટ મની ડિપોઝીટ (ઈએમડી) પણ નીચે જણાવેલ છે ઈ-હરાજીની તારીખ : ૩૦.૧૨.૨૦૨૫ (મંગળવાર) ઈ-હરાજીનો સમય : બપોરે ૧૨:૦૦ થી સાંજે ૦૫:૦૦ સુધી શાખા ભરૂચ-ા પૃથ્વીનગર, સ્ટેશન રોડ, ભરૂચ, ગુજરાત, ૩૯૨૦૦૧ શાખાનો સંપર્ક- શ્રી જયેશ ચોધરી મોબાઈલ નંબર ૯૯૬૩૫૯૫૧૫૦

અ. નં.	દેવાદારનું નામ	भिલકतनी વिગतो	મિલકતના	भिલકतनो प्रકार	તા. ૩૦.૦૯.૨૦૨૫ મુજબ બાકી રકમ	રીઝર્વ કિંમત રૂા. માં
σi.	CHICKEGI ON I	मिल्डलना प्रियता	માલીકનું નામ	કબજાનો પ્રકાર	(રૂા. લાખમાં)	ઈએમડી રૂા. માં
1	શ્રી હરીયભાઇ વાઘેલ (દેવાદાર અને ગીરવેદાર)	સુરત જિલ્લા, સબ-ડિસ્ટ્રિક્ટ માંગરોળ, મોજે ગામ હથુરન, આર.એસ. નં. 939, 93c, 93c એન.એ. ખાતે આવેલી સ્થાવર મિલકતના તમામ ભાગો અને પાર્સલ કુલ આશરે ૧-૬૦-૦૦ "ડિવાઇન વિલા", પ્લોટ નં. ૫૫, કુલ અંદાજે વિસ્તાર ૪૪.૬૨ ચોરસ મીટર, વારડે જમીન: ૧૪.૭૨ ચોરસ મીટર, મીટર	શ્રી હરીષભાઈ રમણભાઈ વાદોલ	રહેશાંક	૧૦.૧૪ + વ્યાજ	३ Ⅰ. ૩,⋲⋲,੫੦੦.੦੦
		ત્થારબાદ તેના પર બનાવેલ/સ્થાપિત અને નીચે મુજબ સીમા ધરાવતા મકાન અને નિશ્ચિત માળખાના બાંધકામ સાથે અને ચતુ:સીમા નીચે મુજબઃ પૂર્વઃ- જેડાચેલ સોસાચટી રોડ, પશ્ચિમઃ- જોડાચેલ પ્લોટ નં.યડ, ઉત્તરઃ- જોડાચેલ પ્લોટ નં.૫૪, દક્ષિણઃ- જોડાચેલ પ્લોટ નં.૫૬		સાંકેતિક	+ ખર્ચાઓ	₹I. 3€,€ Ч 0.00

બેંકની જાણ પ્રમાણે મિલકત પરના બોજાની વિગતો : નથી

સંપર્ક વિગત : શ્રીમતી અમન સક્સેના મો. ૯૪૫૫७૨૯૯७૩, શ્રી અનુભવ સિંઘ મો. નં. ७२०૧૯૧૯૮૬૪, શ્રી મનોહર સિંઘ મો. નં. ૮૨૦૯૮૯૪૯૯૪

. ઉપરોક્ત કથિત લોન(સ)ના દેવાદારો (રો) અને જામીનદાર (રો)ને સિક્યોરીટી ઈન્ટરેસ્ટ (એનફોર્સમેન્ટ) નિયમો 200૨ના નિયમ ૮(૬)/ નિયમ ૯(૧) હેઠેળ ઉપર જણાવેલ તારીખે ઈ-હરાજી વેચાણ યોજવા માટે કાનુની 30/૧૫ દિવસર્ન

મિલક્તોના નિરીક્ષણ માટે તારીખ અને સમયઃ ૨૯/૧૧/૨૦૨૫ થી ૨૯/૧૨/૨૦૨૫ ના રોજ સવારે ૧૧:૦૦ થી સાંજે ૪:૦૦ વાગ્યા સુધી

વેચાણના વિગતવાર નિયમો અને શરતો માટે બેંકની વેબસાઈટ લીંક https://www.unionbankofindia.co.in જુઓ. ૨જીસ્ટ્રેશન, લોગઈન અને બિડીંગના નિયમો માટે https://baanknet.com ની મલાકાત લો.

નોંદાઃ હરાજાના અંતિમ સમય પહેલા ઈએમડી જમા કરાવવાની રહેશે અને ઈએમડી રકમને મિલકત આઈડી સાથે લિક/મેપ કરવાની રહેશે અધિકૃત અધિકારી, તારીખ : ૨૮/૧૧/૨૦૨૫, સ્થળ : વકોદરા

ચુનિયન બેંક ઓફ ઈન્ડિયા

માહિતો માટે

ન્યુઆર સ્કેન કરો